

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૬/૨૦૧૬ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૨ કેસ કરી, ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૨૨૨ લીટર દેશી દારૂ, ૧૧૭૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ બિયર ટીન, ૨ મોટર સાયકલ અને ૧ કાર કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૧/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૧૦૩૨/૧૬

વેજલપુર: ઉર્વસીબહેન સુરેશભાઈ પરમાર (ઉ.વ.૧૭)(રહે.નારાયણ માલાની ચાલી કેન્સર હોસ્પિટલ પાસે વાસણા) ને તા.૨/૫/૧૬ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી આરોપી દિપકભાઈ દિનેશભાઈ રાઠોડ (રહે.ગુપ્તાનગર વાસણા) લગ્ન કરવાની લાલચ આપી લાલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ ઉર્વસીબહેનની માતા રમિલાબહેન પરમારે તા.૨/૬/૧૬ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર કે ઝાલા ચલાવે છે.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૩૩/૧૬

નવરંગપુરા: જયવીર અજીતસિંહ ચૌહાણ (રહે.અવની રો હાઉસ એન્ડ બંગલોઝ ડીમાર્ટની પાછળ વીસત હાઈવે મોટેરા) એ તા.૨/૬/૧૬ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૯/૧૦/૧૫ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન નવરંગપુરા લો-ગાર્ડન ઈન્ડીયા ઈન્ફોલાઈન ફાયનાન્સ લીમીટેડ ખાતેથી આરોપી જીતેન્દ્ર ચંદ્રપ્રકાશ સોની (રહે. રાજ એવન્યુ ડુપ્લેક્ષ ન્યુ સીજી રોડ ચાંદખેડા) ગોલ્ડ લોન લેવા માટે સોનાનું ૫૬ ચઢવેલ બીજી ધાતુના દાગીના રજુ કરી રૂપિયા ૧,૯૨,૨૦૦/- અને ત્યારબાદ રૂપિયા ૩,૫૬,૩૦૦/- ગોલ્ડ લોન મેળવી લઈ લોનના હપ્તા નહી ભરી કંપની સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનાની તપાસ પ્રો.પો.સ.ઈ.શ્રી સી બી રાઠોડ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૦૩૪/૧૬

નરોડા: જયરામભાઈ વનવીરભાઈ દેસાઈ (રહે.સારથી બંગલોઝ હરીદર્શન ચાર રસ્તા પાસે કઠવાડા રોડ નરોડા) એ તા.૩૧/૫/૧૬ રાતના ૧૦/૩૦ વાગે નરોડા ભગત પેટ્રોલપંપ નજીક પોતાની આઈવા કાર નંબર જીજે ૧૮ એવી ૭૮૬૨ કિમત રૂપિયા ૧૬,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧/૬/૧૬ કલાક ૬/૦૦ વાગ્યા દરમિયાન થઈ હતી. આ અંગેની ફરીયાદ જયરામભાઈ દેસાઈએ તા.૨/૬/૧૬ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી કે એચ જાડેજા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૩૫/૧૬

શહેરકોટડા: અમૃતાબહેન અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૪) (રહે.આંબેડકરનગર મેમ્કોબ્રીજની સામે મેમ્કો) એ કોઈ કારણસર તા.૨/૬/૧૬ કલાક ૭/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મદદનીશ પોલીસ કમિશનર.શ્રી ડી ડીવીજન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.